

જુલાઈ 13, 2018

મતદાનના 100 દિવસ બાકી બચ્યા છે – શું તમે મત આપવા તૈયાર છો?

બ્રામ્પટન, ઓન્ટેરિયો – ઓક્ટોબર 22 નાં રોજ બ્રામ્પટનના મતદાતાઓ મ્યુનિસિપલ ચૂંટણીમાં મત આપવા પોતાનો મહત્વનો નિર્ણય લે ત્યાં સુધી આ અઠવાડિક રજાઓથી 100 દિવસ બાકી બચે છે.

“અમે એડવાન્સ વોટિંગ પીરિયડ (અગાઉથી મતદાન કરવાનો સમયગાળો) લંબાવીને, અને મતદાતાઓને ઓક્ટોબર 22 નાં રોજ પોતાનો મત આપવા પોતાના વોર્ડમાં સ્થળોની પસંદગી પૂરી પાડીને લોકો માટે મત આપવાનું વધારે સરળ બનાવી રહ્યા છીએ,” પીટર ફે (Peter Fay), 2018 મ્યુનિસિપલ ચૂંટણી માટે સીટી ક્લાર્ક અને રિટર્નિંગ ઓફિસર (ચૂંટણી અધિકારીઓ) કહ્યું. “રસ્તાઓ, બગીચાઓ, મનોરંજન અને પરિવહન જેવી મ્યુનિસિપલ અને પ્રાદેશિક સેવાઓ રહેવાસીઓના રોજંદા જીવનનો મહત્વનો ભાગ છે. મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાન તમારા શહેરને આકાર આપવા એક મહત્વની રીત છે.”

મતદાન સરળ છે – અહીં મતદાતાઓ માટે કેટલાક ઉપયોગી સ્મૃતિપત્રો (રિમાઈન્ડર્સ) આપેલા છે:

- ✓ **નિર્ધારિત કરો કે શું તમે એક પાત્રતા ધરાવનાર મતદાતા છો**
એક કેનેડિયન નાગરિક, ઓછામાં ઓછાં 18 વર્ષની ઉંમરના, જેઓ બ્રામ્પટનમાં રહેતા હોય (અથવા બ્રામ્પટનમાં જમીનના માલિક કે ભાડુઆત હોય અથવા આવા માલિક કે ભાડુઆતના પત્ની કે પતિ હોય).
- ✓ **તમારો વોર્ડ જાણો**
જો તમે રહેતા હો ત્યાંના વોર્ડ વિશે અચોક્કસ હો તો, [અહીં](#) તપાસો.
- ✓ **તમારા વોર્ડમાં કોઈપણ જગ્યાએ મત આપો**
ઓક્ટોબર 22 નાં રોજ, તમે તમારા વોર્ડમાં કોઈપણ સ્થળે મત આપી શકો છો. મતદાન દિવસ નજીક આવતા મતદાન સ્થળની માહિતી [અહીં](#) ઉપલબ્ધ થશે.
- ✓ **એડવાન્સ વોટિંગ ડેટ્સ (અગાઉથી મતદાન કરવાની તારીખો)**
જો તમે ઓક્ટોબર 22 નાં રોજ મત ના આપી શકો તો, આ એડવાન્સ વોટિંગ ડેટ્સ વિચારો: ઓક્ટોબર 2, 3, 4, 6, 9, 10, 11 અને 13.
- ✓ **પ્રોક્સી મતદાન**
જો તમે પાત્ર બ્રામ્પટન મતદાતા હો જે મતદાન દિવસે અથવા એડવાન્સ વોટિંગ ડેટ્સમાં મત ના આપી શકે તો, તમે તમારા વતી પાત્રતા ધરાવનાર બીજા કોઈ બ્રામ્પટન મતદાતાને નિમી શકો. મતદાતાઓની યાદીમાં નામ ધરાવનાર અથવા મતદાતાઓની યાદીમાં નામ ઉમેર્યું હોય તેવી કોઈ વ્યક્તિ પ્રોક્સી દ્વારા મત આપી શકે. પ્રોક્સી મતદાનને લગતી વધુ માહિતી વેબસાઈટ www.brampton.ca પર જલદી ઉપલબ્ધ થશે.
- ✓ **તમારું આઈડી (ઓળખપત્ર) લાવો**
મતદાતાઓએ પોતાનું નામ અને પોતાને મત આપવા લાયક બનાવતું બ્રામ્પટનનું સરનામું ટેબાડતી ઓળખનો એક નમૂનો અચૂક લાવવો રહ્યો. ઓળખ માટેના સ્વીકાર્ય દસ્તાવેજો [અહીં](#) જોઈ શકાય છે.

આ ચૂંટણીમાં નવું

આ ચૂંટણીમાં, પીલ રીજીયનલ ચેર સામાન્ય મતથી ચૂંટવામાં આવશે. આનો અર્થ એ થાય કે રીજીયનલ ચેર માટેના ઉમેદવારો વર્ષ 2018 માં મતદાન પર રહેશે. વધુ માહિતી [અહીં](#) મેળવો.

2018 મ્યુનિસિપલ ચૂંટણી વિશે વધુ માહિતી મેળવવા, વેબસાઈટ www.brampton.ca/bramptonvotes જુઓ.

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.